

**ગુજરાત યુનિવર્સિટી**  
**M.Sc. SEM-1 (કેમેસ્ટ્રી) 2017**  
**બીજો તબક્કો પૂર્ણ થયા પછીની પ્રવેશ પ્રક્રિયા**  
ત્રીજા તબક્કાની ઓફલાઇન પ્રવેશની પ્રક્રિયા નીચે મુજબ થશે.

1. Non Reported / Not allotted/ Cancelled પ્રવેશના કારણે ખાલી રહેલ જગ્યાઓ ફાળવવા માટે પ્રક્રિયા થશે.
2. ઓફલાઇન (તબક્કા - 3) માટે નીચેનામાંથી કોઈપણ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ, પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
  - એડમીશન મળેલ હોય તેવા વિદ્યાર્થીઓ
  - એડમીશન મળેલ હોય પણ ફી ભરી ના હોય તેવા વિદ્યાર્થીઓ
  - એડમીશન ના મળ્યું હોય તેવા વિદ્યાર્થીઓ
  - ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન કરેલ હોય પણ ડોક્યુમેન્ટસ રજૂ કરવવામાં અસમર્થ રહેલા વિદ્યાર્થીઓ
  - જેમણે ઓનલાઇન ફોર્મ ભર્યું ના હોય તેવા વિદ્યાર્થીઓ.(Fresh Students)

**વિદ્યાર્થીઓ માટેની સૂચના**

FRESH STUDENTS કે જેમણે ઓનલાઇન ફોર્મ ભરેલ ના હોય તેવા વિદ્યાર્થીઓએ પિન વિતરણ કેન્દ્ર પરથી પીન ખરીદવાનો રહેશે. (પિન વિતરણ કેન્દ્ર: Department of Zoology, University School of Sciences, Gujarat University, Ahmedabad-009.) તે પિન નો ઉપયોગ કરી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

બધાજ વિદ્યાર્થીઓએ પોતાના પીન નંબર, રજીસ્ટ્રેશન નંબર અને સિરિયલ નંબર નો ઉપયોગ કરી ઓનલાઇન ભરેલ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. (11/08/2017 પછી ડાઉનલોડ કરેલ હોવું જોઈએ)

રસાયણશાસ્ત્ર વિષય માં ઓફલાઇન એડમિશન માટે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, સ્કૂલ ઓફ સાયન્સ , ગુજરાત યુનિવર્સિટી માં ફોર્મ જમા કરાવવું ફરજિયાત છે.

12/08/2017 થી 19/08/2017 સુધિમાં સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન ( રજા ના દિવસ સિવાય)

**ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટસની વિગત :**

(જરૂરી ડોક્યુમેન્ટસ ની ઝેરોક્ષ જોડવી અને ફોર્મ જમા કરાવતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સાથે રાખવા)

- ઓનલાઇન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ
- સેમ-VI અને સેમ-V ની માર્કશીટ નકલ
- જો અનામત કેટેગરી માં સમાવેશ થતો હોય તો અનામત કેટેગરી નો દાખલો

- OBC કેટેગરી માં સમાવેશ થતાં વિદ્યાર્થીઓએ, માન્ય નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું
- PH (PHYSICALLY DISABILITY) કેટેગરી માં સમાવેશ થતાં વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન પાસેથી કઢાવેલ PH-સર્ટિફિકેટ જોડવું.
- અન્ય યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ તા:19-08-2017 અથવા તેનાથી પહેલા કઢાવેલ PEC (PROVISIONAL ELIGIBILITY CERTIFICATE) જોડવું.

પિન માટેની માહિતી	સમય અને તારીખ
ફેશ વિદ્યાર્થીઓએ પિન વિતરણ કેન્દ્ર પર થી પિન મેળવવાની રહેશે.	<b>12/08/2017 થી 18/08/2017</b> સવારે ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી ( રજા ના દિવસ સિવાય)

નોંધ : 19/08/2017 પછીની પ્રક્રિયાનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઇટ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.